

Nehru House, 4 Bahadur Shah Zafar Marg, New Delhi-110002



11th November 2020

P J Towers, Dalal Street Mumbai 400 001 Scrip code: 532162

National Stock Exchange of India Limited Exchange Plaza Plot no. C/1, G Block, Bandra-Kurla Complex, Bandra (East) Mumbai – 400051 Scrip code: JKPAPER

Dear Sir/Madam.

Subject: Buyback of fully paid-up equity shares of face value of Rs. 10 each (the "Equity Shares") of JK Paper Limited (the "Company") under the Securities and Exchange Board of India (Buy-Back of Securities) Regulations, 2018, as amended (the "Buyback Regulations") – Post Buyback Public Announcement

In respect of the captioned subject matter and in accordance with Regulation 24(vi) of the Buyback Regulations, we have issued a public advertisement dated 10th November, 2020 of the Post Buyback Public Announcement, which was published in the following newspapers on 11th November, 2020:

(i) The Financial Express, English national daily, all editions:

(ii) Jansatta, Hindi national daily, all editions; and

(iii) Janadesh, regional language - Gujarati daily, Surat edition.

Copies of Post Buyback Public Announcement are enclosed herewith.

Submitted for your kind information and necessary records.

Yours truly.

For JK Paper Limited,

Deepak Gupta Company Secretary

Enclosures: As above.



Admn. Office: Ph.: 91-11-66001132, 66001112, 23311112-5, Fax: 91-11-23712680, Website: www.jkpaper.com

Regd. Office : P.O. Central Pulp Mills, Fort Songadh, Dist. Tapi (Guj.)-394660

FINANCIAL EXPRESS



Corporate Identity Number ("CIN"): L21010GJ1960PLC018099 Registered Office: P.O. Central Pulp Mills, Fort Songadh, District Tapi, Gujarat - 394 660. Tel.: +91 2624 220228 / 220278-80; Fax: +91 2624 220138; Administrative Office: Nehru house, 4 Bahadur Shah Zafar Marg, New Delhi - 110 002. Tel: +91 11 6600 1132, 2331 1112-5; Website: www.jkpaper.com Contact Person: Deepak Gupta, Company Secretary, E-mail: deepak.gupta@jkmail.com

POST BUYBACK PUBLIC ADVERTISEMENT FOR THE ATTENTION OF EQUITY SHAREHOLDERS/BENEFICIAL **OWNERS OF EQUITY SHARES OF JK PAPER LIMITED**

This post buyback public announcement (the "Post Buyback Public Announcement") is being made in accordance with Regulation 24(vi) and other applicable provisions of

the Securities and Exchange Board of India (Buy-Back of Securities) Regulations, 2018, for the time being in force including any statutory modifications and amendments from time to time ("Buyback Regulations") regarding completion of the Buyback (as defined below). This Post Buyback Public Announcement should be read in conjunction with Public Announcement dated 29" April 2020 and published on 30" April 2020 ("Public Announcement"), issued in connection with the Buyback (as defined below). Unless specifically defined herein, capitalised terms and abbreviations used herein have the same meaning as ascribed to them in the Public Announcement. 1. THE BUYBACK

1.1. Pursuant to the provisions of Sections 68, 69, 70, and all other applicable provisions, if any, of the Companies Act, 2013, as amended ("Companies Act" or the "Act"), the Companies (Share Capital and Debentures) Rules, 2014 ("Share Capital Rules"), the Companies (Management and Administration) Rules, 2014 ("Management Rules"), and the provisions of the Buyback Regulations, Articles of Association of the Company and pursuant to the resolutions passed by the Board of Directors of the Company (the Board of Directors of the Company are hereinafter referred to as the "Board" or the "Board of Directors") at its meeting held on 28" April 2020 ("Board") Meeting"), the Board approved the buyback of the Company's fully paid-up equity shares of the face value of ₹ 10/- (Rupees Ten only) each ("Equity Shares") from its shareholders / beneficial owners excluding promoters, promoter group and persons who are in control of the Company, via the 'open market' route through the stock exchanges, for a total amount not exceeding ₹ 100,00,00,000 (Rupees One Hundred Crore only) ("Maximum Buyback Size"), and at a price not exceeding ₹ 130 (Rupees One Hundred and Thirty only) per Equity Share ("Maximum Buyback Price"), payable in cash (the process being referred hereinafter as "Buyback"). The Maximum Buyback Size does not include any expenses incurred or to be incurred for the Buyback like filling fees payable to SEBI, advisors' fees, stock exchange fees. brokerage, applicable taxes including, inter alia, securities transaction tax, goods and services tax, stamp duty, etc., public announcement publication expenses, printing and despatch expenses and other incidental and related expenses ("Transaction Costs").

1.2. The Maximum Buyback Size represents 5.67% and 5.71% of the aggregate of the total paid-up Equity Share capital and free reserves (which includes the securities premium account) of the Company based on the standalone and consolidated audited financial statements of the Company as on 31" March 2019, respectively (being the latest available audited standalone and consolidated financial statements of the Company as on the date of Public Announcement). Further, since the Maximum Buyback Size was not more than 10% of the total paid - up Equity Share capital and free reserves of the Company in accordance with the proviso to the Section 68(2)(b) of the Act, approval of the shareholders of the Company was not required.

1.3. The Public Announcement for the Buyback was published on 30" April 2020 in all editions of The Financial Express*, the English national daily newspaper, Jansatta, the Hindi national daily newspaper and in Surat edition of Janadesh, Gujarati newspaper, a regional language daily where the registered office of the Company is situated. *As informed by the publication, as a result of then ongoing lock-down due to COVID-19, Public Announcement in Pune edition of The Financial Express was published only in e-newspaper.

1.4. The Buyback commenced on 8" May 2020 and completed on 6" November 2020. Till the date of completion of Buyback, the Company has utilized approximately 83.41% of the Maximum Buyback Size (excluding Transaction Costs):

1.5. The Committee of Directors of the Company took note that in terms of the Public Announcement, 6th November 2020, being the completion of six months from the date of commencement of the Buyback, is the last date for completion of the Buyback. Accordingly, the Committee of Directors of the Company approved the completion and closure of the Buyback on 6" November 2020. Intimation for completion and closure of the Buyback was sent to the Stock Exchanges on 6" November 2020.

1.6. Total number of Equity Shares bought back under the Buyback is 88,41,241 Equity Shares. 2. DETAILS OF THE BUYBACK

and the Company is in the process of extinguishing the remaining 4,01,458 Equity Shares bought back

2.1. The Company bought back an aggregate of 88,41,241 Equity Shares, utilizing a total of Rs. 83,41,27,621.45 (Rupees Eighty three crore forty one lakh twenty seven thousand six hundred twenty one and forty five paisa only) (excluding Transaction Costs), which represents approximately 83.41% of the Maximum Buyback Size. The price at which the Equity Shares were bought back was dependent on the price quoted on the Stock Exchanges. The highest price at which the Equity Shares were bought back was Rs. 103.00 per Equity Share while the lowest price was Rs. 85.50 per Equity Share. The Equity Shares were bought back at an average price of Rs. 94.34508 per Equity Share. These prices are based on contract notes issued by JM Financial Services Limited ("Company's Broker") and exclude Transaction Costs. 2.2. The pay-out formalities have been completed as per settlement mechanism with the Stock Exchanges. The Company has extinguished 84,39,783 Equity Shares till date

2.3. All Equity Shares bought back were in the demat segment from the Stock Exchanges. As the Buyback was done from the open market through the Stock Exchanges, the identity of members from whom Equity Shares exceeding 1% of the total Equity Shares was, if any, bought in the Buyback, is not known.

CAPITAL STRUCTURE AND SHAREHOLDING PATTERN

3.1. The capital structure of the Company as on the date of the Public Announcement and post-Buyback, is as under: As on the date of the Public Announcement Post-Buyback[®] Particulars No. of Shares Amount (in Rs.) No. of Shares Amount (in Rs.) Authorised Share Capital: 300,00,00,000 . Equity Shares of Rs. 10 each 30,00,00,000 300,00,00,000 30,00,00,000 2,00,00,000 200.00.00.000 . Preference Shares of Rs. 100 each 2,00,00,000 200,00,00,000 Issued, subscribed and fully paid-up Share Capital: . Equity Shares of Rs. 10 each 17,82,43,585 178,24,35,850 16,94,02,344 169,40,23,440

Out of the total of 88,41,241 Equity Shares bought back, the Company is in the process of extinguishing the balance of 4,01,458 Equity Shares. The post Buyback Equity Share Capital is assuming extinguishment of all Equity Shares bought back by the Company. The shareholding pattern of the Company pre-Buyback and post-Buyback is as under

Shareholder	Pre-Buyi	back ^{ri)}	Post-Buyback ⁽²⁾		
	Number of Equity Shares	% of Equity Shares	Number of Equity Shares	% of Equity Shares	
(A) Promoter & Promoter Group	8,71,37,211	48.89	8,71,37,211	51.44	
(B) Public	9,11,06,374	51.11	8,22,65,133	48.56	
(C1) Shares underlying DRs		9501			
(C2) Shares held by Employee Trust				- 2	
(C) Non-Promoter Non Public (C = C1 + C2)	2	7/277			
Grand Total (A+B+C)	17,82,43,585	100.00	16,94,02,344	100.00	

Out of the total of 88,41,241 Equity Shares bought back, the Company is in the process of extinguishing the balance of 4,01,458 Equity Shares. The post Buyback Equity Share Capital is assuming extinguishment of all Equity Shares bought back by the Company.

MANAGER TO THE BUYBACK

JM FINANCIAL

7th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai – 400 025, Maharashtra, India. Tel.: +91 22 6630 3030; Fax: +91 22 6630 3330 Contact Person: Ms. Prachee Dhuri; Email: jkpaper.buyback@jmfl.com; Website: www.jmfl.com; SEBI Registration Number: INM000010361 Validity Period: Permanent Registration; Corporate Identity Number: L67120MH1986PLC038784

For further details, please refer to the Company's website (www.jkpaper.com) and the websites of the Stock Exchanges (i.e. www.bseindia.com and www.nseindia.com)

DIRECTORS' RESPONSIBILITY STATEMENT

As per Regulation 24(i)(a) of the Buyback Regulations, the Board of Directors of the Company accepts full and final responsibility for the information contained in this Post Buyback Public Announcement and confirms that such document contains true, factual and material information and does not contain any misleading information. For and on behalf of the Board of Directors of JK Paper Limited

Harsh Pati Singhania **Amar Singh Mehta** Deepak Gupta Vice Chairman & Managing Director President & Director Company Secretary DIN: 00086742 DIN: 00030694 ICSI Membership Number: F4615 Date: November 10, 2020

Place: New Delhi CONCEPT

MAAN ALUMINIUM LIMITED 'IMPORTANT''

Earnings Per Share of Rs. 10/- each

Basic & Diluted EPS

CIN: L30007DL2003PLC214485

Registered office: 4/5, 1st Floor, Asaf Ali Road, New Delhi-110002

Phone: 011-40081800, Website: www.maanaluminium.com, Email: info@maanaluminium.in

Extract of statement of Unaudited financial results for the quarter and six months ended September 30, 2020 (Rs. In lakhs except EPS) Quarter ended Six Month Ended Year Ended Sept. 30, June 30. Sept. 30. Sept. 30. Sept. 30, March 31. **Particulars** 2020 2020 2019 2020 2019 2020 (Unaudited) (Unaudited) (Unaudited) (Audited) (Unaudited) (Unaudited) Total Income from operations gross 9,315 4.993 16,367 14,308 29.958 52,419 452 215 279 667 628 Net Profit before exceptional items and tax 452 215 915 Net Profit for the period before tax 279 667 628 161 755 Net Profit for the period after tax 336 314 497 543 161 753 335 496 538 310 Total comprehensive income for the period Equity share capital 676 676 676 676 676 676

Whilst care is taken prior to

acceptance of advertising

copy, it is not possible to verify

its contents. The Indian

Express (P) Limited cannot be

held responsible for such

contents, nor for any loss or

damage incurred as a result of

transactions with companies,

associations or individuals

advertising in its newspapers

or Publications. We therefore

recommend that readers

make necessary inquiries

before sending any monies or

entering into any agreements

with advertisers or otherwise

acting on an advertisement in

any manner whatsoever.

The above financial results for the guarter and half year ended September 30, 2020 have been reviewed by the audit committee and approved by the Board of Directors at its meeting held on November 10, 2020.

2.38

4.64

7.35

4.97

The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full financial results are available on www.bseindia.com www.nseindia.com and www.maanaluminium.com.

The Board of Directors at their meeting held on 10th November, 2020 declared the Interim Dividend of Re.: 1/-(10%) per Equity Share for FY 2020-2021 on Equity Share Capital of the Company. Further, The Company has fixed November 20, 2020 as the Record Date for ascertaining the eligibility of the shareholders for payment of abovesaid Interim Dividend.

For and on behalf of the Board

8.03

11.17

Place: New Delhi Date: November 10, 2020

(Ravinder Nath Jain) Chairman and Managing Director

DIN: 00801000

WORLD LEADER IN AIR COOLING

SYMPHONY LIMITED

(₹ in Crores) Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Half Year ended September 30, 2020

Quarter Half Year Quarter Half Year **Ended Ended Ended** Ended Particulars 30-Sep-20 30-Sep-19 30-Sep-19 30-Sep-20 (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited) Revenue from operations Profit/(Loss) before exceptional items and tax Exceptional Items Profit/(Loss) after exceptional items and before tax Net Profit after Tax for the year/period Total Comprehensive Income for the year/period [Comprising Profit for the year/period (after tax) and Other Comprehensive Income (after tax)] Paid-up Equity Share Capital (Face Value ₹ 2/- per share)

* EPS is not annualised for the quarter/half year ended September 30, 2020 and September 30, 2019. NOTES:

Basic & diluted (₹)

1. Key numbers of Standalone Results are as under:

Earnings Per Share (of ₹ 2/- each)*

(₹ in Crores)

2.39

Half Year Half Year Quarter Quarter **Ended** Ended Ended **Ended Particulars** 30-Sep-19 30-Sep-20 30-Sep-19 30-Sep-20 (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited) Revenue from operations Profit/(Loss) before exceptional items and tax Profit/(Loss) after exceptional items and before tax Net Profit after Tax for the year/period

2. The above is an extract of detailed format of quarterly/half year ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly/half year ended Financial Results are available on the Stock Exchange websites www.nseindia.com, www bseindia.com and on Company's website www.symphonylimited.com

> By Order Of The Board For Symphony Limited

Achal Bakeri

Chairman & Managing Director


DIN-00397573

Sympheny

World's Largest manufacture of Residential, Commercial and Industrial Air Coolers. Available in more than 60 countries. Symphony Limited, Symphony House, FP-12 TP-50, Bodakdev, Off SG Highway, Ahmedabad 380059, India.

CIN: L32201GJ1988PLC010331 | Web: www.symphonylimited.com | Email: corporate@symphonylimited.com | Phone: +91-79-66211111 | Fax: +91-79-66211139

HOVE DIETS TOUCH CLOUD SILVER! STORE DIET HOOL WINTER SUMO JUMBO WINDOW Artic Circle Moster Cool HI COLLAND BBONAIRE



Transpek Transpek Industry Limited

Registered Office: Marble Arch, 6th Floor, Race Course, Vadodara - 390 007 Tel: 0265-2335444 Fax: 0265-2335758 Email: secretarial@transpek.com Website: www.transpek.com CIN: L23205GJ1965PLC001343

	Standalone (Rs. In Lakhs)							Consolidated (Rs. In Lakhs)				
PARTICULARS	Quarter ended 30th Sept., 2020 (Unaudited)	Quarter ended 30th June, 2020 (Unaudited)	Quarter ended 30th Sept., 2019 (Unaudited)	Half Year ended 30th Sept., 2020 (Unaudited)	Half year ended 30th Sept., 2019 (Unaudited)	Year ended 31st March, 2020 (Audited)		Quarter ended 30th June, 2020 (Unaudited)	The state of the s	30th Sept., 2020	Half year ended 30th Sept., 2019 3 (Unaudited)	Year ended 31st March, 2020 (Audited)
Revenue from Operations	7,729	7,465	12,534	15,194	23,797	56,564	7,729	7,465	12,534	15,194	23,797	56,564
Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(4)	418	1,888	414	2,313	9,352	(4)	418	1,887	414	2,312	9,352
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(4)	418	1,888	414	2,313	9,352	(4)	418	1,887	414	2,312	9,352
Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	57	377	1,546	434	1,881	7,295	57	377	1,545	434	1,880	7,295
Total Comprehensive Income for the period [comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,165	770	1,527	1,935	1,602	4,725	1,165	770	1,526	1,935	1,601	4,725
Equity Share Capital	559	559	559	559	559	559	559	559	559	559	559	559
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	%±	12	Si .	35,082	30,836	33,286	9.4	*	1	35,082	30,836	33,286
Earnings Per Share (of Rs.10/- each)									k-			
Basic & Diluted (Rs.)	1.03	6.74	27.66	7.77	33.66	130.59	1.03	6.74	27.66	7.77	33.66	130.59

Place : Ahmedabad

Date: November 10, 2020

The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results is available on the Company's website at www.transpek.com and the Stock Exchange's Website at www.bseindia.com.

> For TRANSPEK INDUSTRY LIMITED **BIMAL V. MEHTA** MANAGING DIRECTOR DIN: 00081171

financiale

The Indian Express.

For the Indian Intelligent

♦ The Indian EXPRESS

Place: Vadodara

Date: November 9, 2020

फर्जी टीआरपी मामले में रिपब्लिक टीवी के वरिष्ठ कार्यकारी गिरफ्तार

रिपब्लिक टीवी के वितरण प्रमुख ारपाब्लाक टांजा के जितराण प्रमुख धनश्याम सिंह को मंगलवार को कथित फर्जी टीआरपी (टेलीबिजन रेटिंग प्वाइंट) मामले में गिरफ्तार कर लिया गया। मुंबई पुलिस की अपराध शाखा के एक अधिकारी ने यह

अधिकारी ने बताया कि सिंह रिपब्लिक मीडिया नेटवर्क के उपाध्यक्ष भी हैं। उन्हें माडिया नटवक के उपाध्यक्ष भी है। उन्हें भूबह करीब सात बजकर 40 मिनट पर उनके घर से गिरफ्तार किया गया। उन्होंने बताया कि सिंह की गिरफ्तारों के साथ इस मामले में अपराधा शाखा के अपराध आसूचना प्रकोष्ठ (सीआइयू) द्वारा अब तक 12 लोगों की गिरफ्तारी हो चुकी है।

अधिकारी ने नताया कि इससे पहले सीआइयू ने मिस से कई दौर की पृछताछ की थी। टीआरपी घोटाले का खुलासा पिछले महीने तब हुआ, जब बॉडकास- ऑडियंस रिसर्च कार्यीसल (बार्क) ने हंसा रिसर्च ग्रुप के जिए शिकायत दर्ज कराते हुए आरोप लगाया था कि कुछ चैनल टीआरपी के आंकड़ों में छेड़छाड़ कर रहे हैं।

राष्ट्र

प्रकाशित संपादकीय में 2016 के नोटबंदी के मुंबई, 10 नर्वेकर (माझा)।
सिवसेना ने मंगलवार को भाजपा पर हमला
सिवसेना ने मंगलवार को भाजपा पर हमला
स्वार करते हुए कहा कि नोटबंधी को चीश्री सालगिरह
करते हुए कहा कि नोटबंधी को चीश्री सालगिरह
करते हुए कहा कि नोटबंधी को चीश्री सालगिरह
सत्त हुए कहा कि नोटबंधी को चीश्री सालगिरह
सत्त हुए कहा कि नोटबंधी को चीश्री सालगिरह
करते हुए कहा कि नोटबंधी को नुकसान हुआ।
समान हैं, जो इसकी वक्त हर्स बची हुए और
सामना ने दिखा कि फैसले (नोटबंधी के) पर
किनामें से कक्षामी कासहस्ता सक करती थी।
शिवसेना ने अपने मुख्यपत्र 'सामना' में
गीत हुई, नौकरियां चली गई, आत्महत्याएं की

नोटबंदी पर जश्न मनाना पीडितों की कब्र पर केक काटने जैसा : शिवसेना

गईं और करोबार व उद्योग तबाह हो गए, वैसा ही है जैसे ऐसे लोगों की कबों पर जन्मिन का केक काटगा। आठ नवंबर 2016 को 500 और 1000 रुप्त एम पून्य के पुराने नोटों को बंद करने के फैसले की चीथी सालगिरह पर प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा था कि इससे कालाधन कम करने और पारदर्शिता लाने में मदद मिली।

सरेराह पीटने पर पुलिसकर्मी निलंबित

इंदौर (मप्र), 10 नवंबर (भाषा)।

सोशल मीडिया पर वीडियो वायरल होने के बाद यहां पुलिस के एक आरक्षक को निलंबित कर दिया गया है। इस वीडियो में आरक्षक सड़क पर खड़ी पुलिस जीप का दरनाजा लापरवाड़ी से खोलता दिखाई दे रहा है और जब खालता । पखाइ ४ रहा ह जार जब चलती मोटर साइकिल पर सवार दो लोग इससे टकरा कर नीचे गिर जाते हैं तो वह उनमें से एक व्यक्ति को ह ता वह उनम स एक व्यक्ति का बुदी तरह पीटता नंबर आ रहा है। छोटी ग्वालटोली पुलिस थाने के प्रभारी संजय शुक्ता ने मंगलवार को बताया कि वायरल वीडियो का घटनाक्रम रविवार दोपहर का है और इसमें दिखाई दे रहे पुलिस आरक्षक की पहचान कालीचरण के रूप में हुई है। उन्होंने बताया कि वीडियो सामने

उन्होंने वताया कि वीडियो सामन आने के बाद पर महानिरिक्षक (डीआइजी) इतिनारपणाचारी मिश्रा ने पुलिस आरक्षक को निर्सावित कर दिया है। युक्ता ने बताया कि जिस लीडियों के आयार पर आरक्षक को निर्सावित किया गया, वह छोटी ज्यावटोली ध्यान क्षेत्र के मोदी कंपाईंड में लगे असीटीवी कैमरी में कैद हुआ था। वीडियो में आरक्षक मोटर साइकिल समेत नीचे गिरे दो लोगों में से एक व्यक्ति को डंडे से पीटता दिखाई देता है, जबकि यह पाटता विखाइ दता है, जबाक यह अधेड़ शख्स उसके सामने हो जोड़कर रहम की भीख मांगता नजर आता है। पुलिस आरक्षक इस व्यक्ति को थप्पड़ भी मारता है और उसकी शर्ट की कॉल्र एकड़ कर उसे जबरन पुलिस जीप में डालता नजर आता है।

दो वाहनों की टक्कर में छह लोगों की मौत

हैदराबाद, 10 नवंबर (भाषा)।

तेलंगाना के पतानचेरू के पास आउटर रिंग रोड पर मंगलवार को दो गाड़ियों की टक्कर में छह लोगों की मौत हो गई और तीन घायल हो गए।

घायल हो गए।
पुलिस ने बताबा कि उत्तर प्रदेश
गिरस ने बताबा कि उत्तर प्रदेश
गिर को तो लोगों को ले जा रही एक
गाड़ी को दूसरे बाहन ने औवर टेक
करते हुए उक्कर मार दी इस
हादसे में छह लोगों को मौके पर
मौत हो गई थे होणा बंगालुक से आ
दे थे। घायलों को पातानरेक के
अस्पताल में मती कराबा गया है।
पुलिस को शक है कि हाससे का
कारण अधिक रफ्तार से गाड़ी
बलाना हो सकता है।

चित्र अधिक में कि लिमिटेड कि कि मिटेड कि मिटेड

उघारकर्ता/सह-उघारकर्ता/ गारंटर व सम्पत्ति का स्वामी	मांग सूचना की विश्वि	की तिथि	गिरवी समप्ति का विवरण	बकाया राशि सूचना घारा 13(2) के अनुसार
श्री अस्वनी कुमार गौड़(ऋणी), श्री कुलमूषण जैन (गारंटर और बंधक)	13.01.2020		एक्बाईजी फ्लैट नं. 38ए, भूतल, ब्लॉक ए, सेक्टर 99, नोएडा, जिला गौतम बुध नगर, सलार प्रतेश 201304	

दिनांकः 10.11.202 स्थानः नई दिल्ली आईडीबीआई बैंक लिमिटेस

SIRCA PAINTS INDIA LIMITED

SIRCA PAIR 13 INDIA LIBIT ED CIN: L24219DL2006PLC145092 Regd & Corporate office: Plot No. 50, Phase-2, Badii, Industrial Area, Delhi -110042 Tel: +91-11-42083083. Website: https://sircapaints.com. Email: info@sircapaints.com EXTRACT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS OF THE COMPANY FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2020

				STANDALON	E	
SI.		Quarte	r Ended	Six Mon	Year Ended	
No.	Particulars	30.9.2020 Un-audited	30.09.2019 Un-audited	30.09.2020 Un-audited	30.09.2019 Un-audited	31.03.2020 Audited
1	Total Revenue from Operations	3,877.91	4,005.00	5100.65	7,364.06	14,066.59
2	Profit / (Loss) for the period (before tax, Exceptional and / or Extraordinary items)	-564.57	1,321.28	-657.25	2,219.65	3,418.50
3	Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary Items)	-564.57	1,321.28	-657.25	2,219.65	3,418.50
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	-429.30	976.05	-499.08	1620.57	2,515.76
5	Total Comprehensive income for the period	-429.30	975.95	-499.08	1620.37	2,517.46
6	Equity Share Capital	2,740.44	2,740.44	2,740.44	2,740.44	2,740.44
7	Other Equity	15,226.02	15,324.24	15,226.02	15,324.24	15,725.10
8	Earnings Per Share (of Rs. 10/- each) 1. Basic : (not annualised)	(1.57)	3.56	(1.82)	5.91	9.18
	2. Diluted: (not annualised)	(1.57)	3.56	(1.82)	5.91	9.18
				(Fig	ures in Lacs	except EPS)

				(Figi	ures in Lacs i	except EPS)			
		CONSOLIDATED							
SI.		Quarte	r Ended	Six Mon	Year Ended				
No.	Particulars Particulars	30.9.2020 Un-audited	30.09.2019 Un-audited	30.09.2020 Un-audited	30.09.2019 Un-audited	31.03.2020 Audited			
1	Total Revenue from Operations	3,877.91	4,005.00	5,100.65	7,364.06	14,066.59			
2	Profit / (Loss) for the period (before tax, Exceptional and / or Extraordinary items)	-567.00	1,321.28	-659.69	2,219.65	3,418.50			
3	Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary Items)	-567.00	1,321.28	-659.69	2,219.65	3,418.50			
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	-431.11	976.05	-500.89	1620.57	2,515.76			
5	Total Comprehensive income for the period	-431.11	975.95	-500.89	1620.37	2,517.46			
6	Equity Share Capital	2,740.44	2,740.44	2,740.44	2,740.44	2,740.44			
7	Other Equity	15,224.20	15,324.24	15,224.20	15,324.24	15,725.10			
8	Earnings Per Share (of Rs. 10/- each)								
	Basic : (not annualised) Diluted: (not annualised)	(1.57) (1.57)	3.56 3.56	(1.83) (1.83)	5.91 5.91	9.18 9.18			

The above is an extract of the detailed format of Statement of Standalone and Consolidated Financial Results filled with the Stock Exchange under Regulation 33 of the SERI (Listing Diligations and Disclosure Requirements) Begalations, 2013. The full Tornat of the Statement of Standalone Financial Results are available on the Company's website (www.sfrzapaints.com) and on the website of the National Stock Exchange of India Lintiet (downs.seriald.com).

Place : Delhi Date : 10.11.2020

aging Director)

CAPITAL TRUST LIMITED



EXTRACT OF CONSOLIDATED AND STAND ALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER 2020

			Consol	idated			Stand	dalone	
SI. No.	Particulars	Qtr Ended 30.09.2028	Half Year Ended 30.09.2020	Qtr Ended 30.09.2019	Year Ended 31.03.20	Qtr Ended 30.09.2020	Half Year Ended 30.09.2020	Qtr Ended 30.09.2019	Year Ended 31.03.20
1	Total Income from Operations	2,701.95	5,526.07	9,439.07	15,509.11	2,557.92	5,217.54	8,259.30	14,758.00
2	Net Profit(loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	108.74	393.00	767.48	1,363.03	(133.62)	(12.04)	569.89	850.70
3	Net Profit/(loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items)	108.74	393.00	767.48	1,363.03	(133.62)	(12.04)	569.89	850.37
4	Net Profit/(loss) for the period after Tax and Minority Interest (after Exceptional and / or Extraordinary items)	87.47	300.04	236.04	427.41	(90.08)	1.06	89.85	53.29
5	Total Comprehensive income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive income (after tax)]	87.47	300.04	236.04	427.41	(90.08)	1.06	89.85	53.29
6	Equity Share Capital (Face Value Rs. 10 per Equity Share)	1,621.75	1,621.75	1,621.75	1,621.75	1,621.75	1,621.75	1,621.75	1,621.75
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet as on 30th September 2020)	14,124.18	14,124.18	14,124.18	13,824.15	13,787.59	13,924.58	13,787.59	13,788.47
8	Earning per Share (of Rs. 10/- each) (for continuing and discontinuing operations)								
1	I. Basic:	0.54	1.85	1.46	2.64	(0.56)	0.01	0.55	0.33
	II. Diluted:	0.54	1.85	1.46	2.64	(0.56)	0.01	0.55	0.33

The business activity of the Company falls within a single segment viz "francing activities and hence there is no other reportable segment as per ind AS 108.

The Noval Corona vivus (COVID-19) pandemic (declared as such by the World Health Organisation on March 11, 2020) has contributed to significant declares and scaling in organization of the Company of the Comp

has anchorod a surrau of economic neitil measures for USIGE sector, which is accreded to apport becreasity in the color and account and the color which has been deed not been been greated on the color which has been deed not been been greated on the color which has been deed not been present the deed not been present the color which the color which is a color which the color which is a color wh

On behalf of the Board of Directors of Capital Trust Lin

आईएमः कैपिटल्स लिमिटेड पंजीकृत कार्यासयः ॥ १७७७, जेतकि समय, २२ केपी. गार्ग, वर्ष दिस्सी-११०००। सीजाएरः १.744(MDI.1991/P.1254(44017, वेस्साहः : www.imcapitals.com, रं-मेरः imcapitals.imitae@gmail.com, दुरायाः ०११-४३४३३३२ १० सितम्बर, २०२० को सनाव दिनाडि वक्षा कमाही हेतु अलेखारपीवृत स्टैण्डअलीन एसं समेकित वितास परिणानों का विवस्स

								(4. (1) (1)
विवरण		स्टैणह	अलोन			समे	कित	
	समाप्त	तिमाही	समाप्त	छमाही	समाप्त	तिमाही -	समाप्त छमाही	
	३०.०१.२०२० (अलेखापरीक्षित)	३०.०९.२०१९ (अलेखापरीक्षित)	३०.०१.२०२० (अलेखापरीक्षित)	३०.०९.२०१९ (अलेखापरीक्षित)	३०.०१.२०२० (अलेखापरीक्षित)	30.09.2019 (अलेखापरीक्षित)	३०.०१.२०२० (अलेखापरीक्षित)	30.09.2019 (अलेखापरीक्षित)
प्रचालनों से कुल आय	114.53	109.67	209.19	194.83	163.78	180.94	316.65	336.64
कर पश्चात सामान्य गतिविधियों से निवल लाभ	72.67	44.82	116.52	66.95	22.44	71.75	102.40	120.39
कर पश्चात अवधि हेतु निबल लाम (असाधारण मर्दों के पश्चात)	72.67	44.82	116.52	66.95	22.44	71.75	102.40	120.39
अवधि हेतु कुल व्यापक आग [सवधि हेतु लाम/(हानि) (कर पश्चात) तथा	72.67	65.04	116.68	90.10	22.44	91.97	102.57	143.54
क्षन्य व्यापक क्षाय (कर पश्चात) सहित]								
प्रदत्त इक्विटी शेयर पूँजी आय प्रति शेयर (वार्षिकीकृत नहीं) :	350.16	350.16	350.16	350.16	350.16	350.16	350.16	350.16
मूल (रू.)	2.08	1.28	3.33	1.91	0.64	2.05	2.92	3.44

द । उत्पूर्क परिणामों को समीक्षा तथा संस्तुति लेखावरीक्ष समिति छटा को गयी और 10 नवम्बर, 2020 को कारोजित निरेक्षक मण्डल की सम्बद्ध बैटक में करूमोदित को ग निर्विक्त लेखायरीक्षकों ने कर्युक्त सिर्वाय परिणामों को सीमित समीक्षा संचालित को है। उत्युक्त सेवी (सूचीब्द्रता रामित्य एवं प्रकटन करोबारी) विमित्तम, 2015 के विमित्यम 33 के तहत स्टॉक एक्सपेंच को सेवसायरीक्षित हिमाडी परिणामों के निस्तृत प्रस् का सार्वाड है। अत्रेक्षायरीक्षित स्टेण्डक्सोन तथा समीकति विशेषा परिणामों का पूर्व प्रस्त एक्सपेंच की सेवसायर www.beindia.com तथा कमानी की वेबसा www.imcapitals.com पर उपलब्ध है।

विशाल सि निदेशक



60. Tel.: +91 2624 220228 / 220278-80; Fax: +91 2624 220138; . Tel: +91 11 6600 1132, 2331 1112-5; Wabsite: www.jkpaper.com

POST BUYBACK PUBLIC ADVERTISEMENT FOR THE ATTENTION OF EQUITY SHAREHOLDERS/BENEFICIAL OWNERS OF EQUITY SHARES OF JK PAPER LIMITED

This post buyback public announcement (the "Post Buyback Public Announcement") is being made in accordance with Regulation 24(v) and other applica he Securities and Exchange Sear of India (Buy-Back of Securities) Regulations, 2018, for the time being in force including any stimutory modifications a norm into bine ("Buyback Regulations") regarding competion for the Buyback (see Indied below). This Pst Explack Public Announcement should be re-with Public Announcement clear 25" April 2020 and published on 30" April 2020 ("Public Announcement"), issued in connection with the Buyback (se Indied Securities Septically defined been, Implication of the Securities Septically defined been, Implication as cannot be the mine and absolute times and absolute times used the time the Paulic Announcement.

स्थान : नई दिल्ली तिथि : 10 नवम्बर, 2020

Unless specifically defined herein, capitalised terms and abbreviations used herein have the same mensing as accribed to them in the Public Announcement.

1. Plessuant to the provisions of Sections 68, 69, 70, and all other applicable provisions, if any, of the Companies Act, 2013, as amended ("Campanies Act" or the "Act"), the Companies (Share Capital sand Obbeniums) Rules, 2014 ("Sharer Explaid Nations"), the Companies (Share Capital sand Obbeniums) Rules, 2014 ("Sharer Explaid Nations"), the Companies of Management and Animalism Rules ("Campanies Act" or the "Act"), and the Companies of Campanies ("Campanies Act" or the "Act"), and the Companies of Campanies ("Campanies Act" or the "Act"), and the Campanies of Campanies ("Campanies ("Cam

e-reverpose:

1.4 The Bulyask commenced on 8" May 2020 and completed on 8" November 2020. Till the date of completion of Bulyasak, the Company has utilized approximately 8.3.41% of the Maximum Bulyasak Size (secularly in arrasaction Costs).

1.5 The Committee of Directors of the Company bots note that interes of the Public Announcement, 6" November 2020, being the completion of six months from the date of commencement of the Bulyasak, is the last date for completion of the Appacak. Accordingly, the Committee of Directors of the Company approved the completion and closure of the Bulyasak on 6" November 2020, influention for completion and closure of the Bulyasak on 6" November 2020, influention for completion and closure of the Bulyasak on 6" November 2020.

1.6 Total number of Cauly Shares bought back under the Bulyasak is 88,41,241 Equity Shares.

2. DETAILS OF THE RUYBANC.

2. THE COMPANY DOUGHT back an aggregate of 88.41.241 Equity Shares, utilizing a total of Rs. 83.41.27.621.45 (Rupeas Eighty three crore forty one labt liverity seven thousand six hundred hearty one and forty the palsas only) (seeducing Transaction Cossis), which interpresents approximately 28.41% of the Maintum Blysches Cism. The prior at whiten the Eighty Shares were bought back was ready because the sought back was ready because the sound to the Stock Echanges. The Rights for at a whiten the Eighty Shares were bought back was Rs. 18.30 per Eighty Shares were bought back was ready. Shares were bought back was ready and sound in the Stock Echanges. The Eighty Shares shares are sound to the sound

Particulars	As on the date of the	Public Announcement	Post-Buyback ⁽¹⁾	
	No. of Shares	Amount (in Rs.)	No. of Shares	Amount (in Rs.)
Authorised Share Capital:				
 Equity Shares of Rs. 10 each 	30,00,00,000	300,00,00,000	30,00,00,000	300,00,00,000
 Preference Shares of Rs. 100 each 	2,00,00,000	200,00,00,000	2,00,00,000	200,00,00,000
Issued, subscribed and fully paid-up Share Capital:				
Equity Shares of Rs. 10 each	17,82,43,585	178,24,35,850	16,94,02,344	169,40,23,440
III Control of CO. 44 CA4 Construction Change Laurente	ala Alan Maranasana in in Alan a		belonce of 4 Of 4FO Facility	Change The sent Dealers

Out of the total of 88,41,241 Equity Shares bought back, the Company is in the peculity Share Capital is assuring admissioner of a Equity Share Sought as assuring admissioner of a Equity Share Sought is as un Shareholding pattern of the Company pre-Buyback, and post-Buyback, is as un Shareholder

Number of Equity Shares

Number of Equity Shares % of Equity Shares (A) Promoter & Promoter Group (B) Public 8,71,37,211 9,11,06,374 51.44 48.56

(C1) Shares underlying DR (C2) Shares held by Emplo 17,82,43,585 100.00 16,94,02,344

Out of the total of 88,41,241 Equity Shares bought back, the Company is in the process of extinguishing the balance of 4,01,458 Equity Shares. The post Buyba Equity Share Capital is assuming extinguishment of all Equity Shares bought back by the Company.

JM FINANCIAL

Financial Limited
Financial Limited
Financial Limited
Financial Limited
Financial Limited
Financial Repair Limited
Financ

DIRECTORS' RESPONSIBILITY STATEMENT As per Regulation 24()(a) of the Suystack Regulations, the Board of Directors of the Company accepts full and final responsibility for the information contra Post Buyback Public Announcement and confirms that such document contains true, facultural and material information and does not contain any misleading in Fer and on health of the Survey Conference of Conference of the Survey Conference of Conference of the Survey Conference on Conference of the Survey Conference on Conference of the Survey Conference on Confe

	Sd/-	Sd/-	Sd/-
	Harsh Pati Singhania	Amar Singh Mehta	Deepak Gupta
	Vice Chairman & Managing Director	President & Director	Company Secretary
	DIN: 00086742	DIN: 00030694	ICSI Membership Number: F4615
ı	Defor November 10, 2020		

Place: New Delhi

Maligal |

દિવાળી પુર્વે યોજાયેલી નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા કુસ્કાઇ ગઇ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેનની અંતિમ સભા

નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત -મુખ અમિતાબેન પટેલની અધ્યક્ષતામાં મળી હતી. આ સામાન્ય સભા આવનારી ચુંટણીને લઇને અંતિમ હોવાનું કહીને -મુખ અમિતાબેનના શાસન દરમિયાન કરેલા કરોડોના કામો અંગેની રૂપરેખા દર્શાવી હતી. આ સભામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ગ્રાંટો અંગેની ઉપલબ્ધિ બતાવી તમામ શાસક અને વિરોધ પક્ષોના સાથ સહકાર દ્વારા કરેલી કામગીરી દર્શાવી હતી. પરંતુ આજની સભામાં ઉડીને આંખે વળગતી બાબત એ હતી કે હાજર રહેલા વિરોધ પક્ષના સભ્યો નિરૂત્સાહ જોવા મળી રહયા હતા.



મંગળવારે નવસારી જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા પંચાયત -મુખ અમિતાબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં આરોગ્ય, ખેતીવાડી અને પંચાયત કર્મચારીઓના જર્જરીત આવાસ અંગે –ાધાન્ય આપીને નવા બાંધકામ અંગેની માહિતી પુરી પાડી હતી. આ ઉપરાંત

જિલ્લા પંચાયત હસ્તકના રોડને લાગતા કામોને -ાધાન્ય આપીને પૂરા કરાવ્યા હોવાનું જણાવ્યુ હતુ. જિલ્લા પંચાયત -જિલ્લાની -જાને લગતા કરોડોના કામોને વેગવંતા બનાવીને પુરા કર્યા હોવાનું જિલ્લા પંચાયતના વોર્ડ નં. ૧૪ ના

ખુંધ ગામના સભ્ય મંજુલાબેને ગ્રામપંચાયતનું મકાન જર્જરીત હોવાથી તોડી પડાયુ હોય અને હાલમાં શાળાનો ઉપયોગ મુખે પોતાની ટર્મ દરમિયાન કરીને સંચાલન થતુ હોય તો વહેલી તકે નવા ગ્રામ પંચાયતનો ઉકેલ લાવી નવા ગ્રામ પંચાયત બાંધવાની કામગીરી માટેનો -' ઉઠાવ્યો

નવસારી જિલ્લામાં પ દિવસ, તાપમાન ૧૩.૫ ડિગ્રી કોરોના પોઝીટીવ

નવસારીઃ નવસારી જિલ્લામાં તાપમાન ૧ ડિગ્રી ગગડતા આજે ૫ કેસ કોરોના પોઝીટીવનો ૩૩.૫ ડિગ્રીએ યથાવત રહયુ મળી આવતા જિલ્લામાં કુલ હત. જ્યારે લધુત્તમ તાપમાન ૧૩૫૮ કેસો નોંધાયા છે. ૧.૫ ડિગ્રી ગગડતા ૧૩.૫ ડિગ્રી નોંધાતા આ સિઝનનો **નવસારી,** નવસારીમાં લધુત્તમ સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. પોઝીટીવના મળી આવ્યા છે. જેમાં જલાલપોર તાલુકામાં ૨, મંગળવારે સવારે વાતાવરણમાં ગણદેવી તાલુકામાં ૨ અને ચીખલી તાલુકામાં ૧ કેસ નોંધાયો છે. જલાલપોર તાલુકાના સુખમડા ફળિયામાં રહેતો યુવાન, જલાલપોર તાલુકાના એથાણ

ગણદેવી માણેકપોર સોસાયટી ફળિયામાં રહેતા બે યુવાન ભાઇઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો મંગળવારે જિલ્લામાં કોરોના છે. જેથી હાલ જિલ્લામાં કેસો પોઝીટીવનો ૫ કેસ કોરોના ૧૩૫૮ કેસો નોંધાયા છે. જ્યારે આજે ૪ કોરોના પોઝીટીવ દર્દીઓએ કોરોનાને માત આપતા જિલ્લામાં કુલ ૧૨૩૪ દર્દીઓ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાને પગલે નિપજેલા મોતનો આંકડો કુલ ૧૦૧ ઉપર સ્થિર રહયો છે. હાલ જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓ વધતા ૨૩ દેગામ કુંભારવાડમાં રહેતો યુવાન દર્દીઓ સારવાર હેઠળ છે.

સિઝનનો સૌથી ઠંડો દિવસ ભેજનું પ્રમાણ ૮૪ ટકા હતુ. જે નોંધાયો છે. બપોર બાદ ધટીને ૪૭ ટકાએ યુનિ. ૨હયુ હતુ. જ્યારે આજે દિવસ નવસારી કૃષિ હવામાન વિભાગ પાસેથી દરમિયાન દિશાએથી ૪.૪ કિ.મી. ઝડપે મળતી માહિતી મુજબ, ગામે રહેતો યુવાન, ચીખલીના મંગળવારે નવસારીમાં મહત્તમ પવનો ફુંકાયા હતા. ડાભેલની જમીન બીનખેતીની કરવા માટે ૩.૪૬ લાખની

નવસારીમાં સિઝનનો ઠંડો

લાંચ લેનાર વચેટીયો અલ્તાફ એક દિવસના રિમાંડ ઉપર ૩.७૮ લાખની લાંચ માંગનાર નવસારી નાચબ મામલતદાર ભેરવાચો

નવસારી,

તાપમાનમાં ધટાડો

જલાલપોર તાલુકાના ડાભેલ ખેતીની જમીન બીનખેતીની કરી આપવા માટે નવસારીના નાયબ મામલતદાર નિલેશ પરમારે ૩.૭૮ લાખની લાંચ માંગી હતી, જે લેતાં ખાનગી વ્યક્તિ અલતાફ શેખ વલસાડ એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. જેને નવસારી એસીબીએ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

નાગરીક એક જાગૃત ફરિયાદીએ જલાલપોર તાલુકાના ડાભેલ ખાતે આવેલ જમીન બીન ખેતી કરાવી આપવા માટે કામ હતો. જેથી જાગૃત નાગરિકે માંગણી કરી હતી. જે લાંચની રકમ



નવસારીના નાયબ મામલતદાર નિલેશ રાજેન્દ્રભાઈ પરમારનો સંપર્ક કરતા તેઓએ ફરીયાદીને એક ચોરસ મીટર દીઠ ૧૭ રૂપિયા -માણે કરવાનો ઓથોરીટી પત્ર મેળવ્યો રૂપિયા ૩.૭૮ લાખ લાંચની

બીજા આરોપી લૂન્સીકુઇ ખાતે નૂર એપાર્ટમેન્ટ ખાતે રહેતા અલતાફ અલ્લારખુ શેખ મારફતે ઉઘરાણી કરાવતા અલતાફે જાગૃત નાગરિક સાથે રૂબરૂ તેમજ ટેલીફોનીક વાતચીત કરી રૂપિયા ૩.૭૮ લાખ રૂપિયા આપવા નક્કી કર્યું હતું. લાંચની ૨કમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોય વલસાડ અને ડાંગ એ.સી.બી પોલિસનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેથી વલસાડ એસીબીએ છટકું ગોઠવ્યુ હતું. આજે રવિવારે નવસારી લુન્સીકૂઇ ખાતે બ્રહ્માકુમારી આશ્રમ સામે નાયબ મામલતદાર નિલેશ પરમાર વતી અલતાફ શેખે જાગૃત નાગરિક સાથે

નિલેશ પરમાર સાથે ફરીયાદીની ટેલીફોનીક વાતચીત મુજબ જાગૃત નાગરિક પાસે લાંચની માંગણી કરી હતી. જેથી અલતાફ શેખે રૂપિયા ૩.૪૬ લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. સાથે જ પોલીસે લાંચના ૩.૪૬ લાખ રૂપિયા કબજે કર્યા હતા.

મંગળવારે નવસારી એસીબી પોલીસે આરોપી અલ્તાફને નવસારી કોર્ટમાં ૨જ કર્યો હતો. જ્યાં એસીબીએ ૭ દિવસના રિમાંડની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી અલ્તાફને એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પરંતુ નાયબ મામલતદાર નિલેશભાઈ

પહેલા ૧૯૯૫ અને ૨૦૧૩માં પેટા ચૂંટણી જીતી હતી

લીંબડીમાં કિરીટસિંહ રાણાની ત્રીજી વખત જીત

લીબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ચૂંટણી જીતી ગયા છે. આ બેઠક પર મતગણતરી હાલ ચાલુ છે પરંતુ ભાજપના ઉમેદવાર કિરીટસિંહ ને એટલી લીડ મળી છે કે તેમની જીત નિશ્ચિત છે. કૉંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ પટેલના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણાને ટિકિટ આપી હતી. અહીં એ જાણવું રસપ્રદ છે કે આ બેઠક પર કિરીટસિંહ રાણા ત્રીજી વખત પેટા-ચૂંટણી જીતી ગયા છે.



આ અમારા ગ્રાહકોને અને જાહેર જનતાને જણાવવાનું છે કે અમારી **સુરત** શાખા, જે ચોથો માળ, દુકાન નં ૪૦૯- ૪૧૦,માર્વેલા બિઝનેશ હબ. હજીરા રોડ, પાલ આરટીઓ સામે અંડાજણ, સુરત, ગુજરાત-૩૯૫૦૦૯ ખાતે આવેલ છે, તે ત્રીજો માળ નંબર ३०१-३१०, २१ सेन्युरी जिञ्जनेस સેન્ટર રીંગરોડ, સુરત, ગુજરાત-૩૯૫૦૦૨ ખાતે સ્થળાંતર થશે. ગ્રાહકોને વિનંતી છે કે તેમની જરૂરિયાતો માટે નવી ઓફિસે

પ્રાદેશિક વ્યાપાર વડા

४भीन अने બિલ્ડીंગना વેચાણ માટે ઈ-હરાજી નોટીસ

स्थणः नवनीत शाह ઓદ્યોગીક એસ્ટેટ. સેલવાસ જમીનનું ક્ષેત્રફળઃ ૫७,૯૧૦ ચોરસ મીટર અને કુલ બિલ્ટઅપ એરિયાઃ 27,708.03 ચોરસ મીટર

વધુ માહિતી માટે કૃપા કરીને સંપર્ક કરો



શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લિમિટેડ જાહેર નોટીસ

અમારા ગ્રાહકોને અને જાહેર જનતાને જણાવવાનું છે કે અમારી **સુરત** પ્રાદેશિક કચેરી, જે ચોથો માળ, દુકાન નં-૪૦૯- ૪૧૦, માર્વેલા બિઝનેશ હબ, હજીરા રોડ, પાલ આરટીઓ સામે, અડાજણ, સુરત, ગુજરાત-૩૯૫૦૦૯ ખાતે આવેલ છે, તે ત્રીજો માળ નંબર 309-390,२१ सेन्ययुरी બिઝनेस सेन्टर રીંગરોડ, સુરત, ગુજરાત-૩૯૫૦૦૨ ખાતે સ્થળાંતર થશે

ગ્રાહકોને વિનંતી ચે કે તેમની જરૂરિયાતો માટે નવી ઓફિસે સંપર્ક કરો.

પ્રાદેશિક વ્યાપાર વડા

હેતુલક્ષી વાતચીત કરી ટ્રેપ દરમ્યાન પરમાર હજી પોલીસ પકડથી દૂર છે. ટાટા કેપિટલ ફાઇનાન્શ્ચલ સર્વિસીસ લિમિટેડ પંજુકૃત કાર્યાલય - અગિયાઓ માળ, ટાવર એ, પેનીન્યુલા બિઝબેસ પાર્ક, ગણપતરાય કદમ માર્ગ, લોઅર પરેલ, મુંલઈ - ૪૦૦૦૧૩ CIN NO.U67190MH2008PLC187552

કબજો નોટિસ

સેક્ચરીટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ રૂલ્સ ૨૦૦૨ ની પરિશિષ્ટ IV મુજબ (કલમ ૮ (૧) વાંચવું) ोचे सही इरनार रारा ईपिरव झांछनान्थ्यत सर्विसीस विभिटेनना अधिङ्कृत छे अर सेड्युदिटिज्ञशन એन्ड रिडन्स्ट्रहशन ઓફ ફांछनान्थ्यत એસેટ અને सेड्युरीटी छन्टरेस એક્ટ ૨૦૦૨ અને સેક્ચુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) એક્ટ ૨૦૦૨ માં મળેલ સત્તાની રૂએ કલમ ૧૩ (૨) હેઠળ, કલમ ૩, એક ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં નોટિસ કલમ ૧૬ (૨) હેઠળ, કલમ ૩, અક ડિમાન્ડ નાટસ મોકલવામાં આવા હતો, જેમાં નાટિસ માલ્યાને ફુંં દિવસની અંદર જણાવેલ રકમ ચૂકની દેવા માટે કેહવામાં આવું હતું। જોકે લોન લેનાર રકમ ચુકવવામાં નિષ્ફળ ગયા હોય, આ નોટિસ થકી લોન લેનાર અને જાહેર જનતા ને જાણવામાં આવે છે કે જિલ્લા કલેક્ટર, સુરત દ્વારા આપવામાં આવેલ ચુકાદા આપવામાં આવ્યો છે, તે મુજબ એક્ઝુક્ચુટીવ મેજુસ્ટ્રેટ દ્વારા અધિકૃત અધિકારીને ગીરવે મુકવામાં આવેલ મિલ્કતનો કબળે સીંપવામાં આવ્યો છે. આ મિલકત ઉપર કોઇ પણ -કારનો વ્યવહાર કરવો નહીં અને જો આમ થશે તો ટાટા કેપિટલ ફાઇનાંન્શ્યલ સર્વિસીસ કારણ ધ્યવણ કરવા ગણ છે. જો તે આવે કરો તો દા કાયલ કોઇલાં કારણ કોઇલાં કોઇલાં લોકો લિમિટેડને લાગુ પડતું વ્યાજ, પીનલ ભાજ, ખર્ચ અને કિંમત ચૂક્વવું પડશે, જેની નોંદ લેવી દેવાદાર / સહ દેવાદાર અને ગેરેન્ટર સર્ફચાસી એક્ટની ક્લમ ૧૩ (૮) અંતર્ગત ગીરદે મુકેલ મિલકત છોડાવી શકે છે.

ઓબ્લિગેટોર / કાયદાકીય વારસદાર / કાયદાકીય પ્રતિનિધિનું નામ નીચે જણાવેલ તારીખ પ્રમાણે કુલ બાકી (રૂ માં) કિમાન્ડ નોટીસની તારીખ સો.સી. નંબર श्री नंहङ्गभार निषाह (सोन सेनार) Rs.9,86,518/- 15.06.2019 17.03.2020 શ્રી પ્રહલાદ બાંકેલાલ (સહ-દેવાદાર) as on 15.06.2019 07.11.2020 CC/1659/201

ગીરવે મૂકવામાં આવેલ મિલ્કતનું વર્ણન : સમગ્ર જમીન અને મિલકત, પ્લોટ નંબર ૬૪ (કે.જે. Yબ oલોક નંબર 360/૨/૬૪), ક્ષેત્રફળ ૪૮ ચોરસ ચાર્ડ એટલે કે ૪૦.૧૫ ચોરસ મીટર, રોડ ચ ઓપીમાં અવિભાજીત હિસ્સા સાથે, રાહી ટાઉનશીપ વિભાગ-૨, ખાતા નંબ૨ ૬७૫, રેવેન્થુ ાંબર ૧૩૬ અને ૧૩૮, બ્લોક નંબર 3७०, પૈકી ૨, ક્ષેત્રફળ હેક્ટર આરે૦-૯૬-૪૧ ચોરસ મીટર - ૪૬૧ ચોરસ મીટર મોજે ગામઃ કારેલી, તાલુકાઃ પલસાણા, જિલ્લોઃ સુરત પૂર્વમાં - પ્લોટ નંબર પ ાશ્ચિમમાં - સોસાથટી રોડ, ઉત્તરમાં - પ્લોટ નંબર દૂપ, દક્ષિણમાં - પલોટ નંબર દૂ૩

10138618	શ્રી ઓમપ્રકાશ પટેલ (લોન લેનાર)	Rs.19,64,558/-	27.05.2019	19.03.2020
10138018	શ્રી સુમાનીદેવી સિંહ (સહ-દેવાદાર)	as on 27.05.2019	07.11.2020	CC/1656/2019
ગીરવે મુક	વામાં આવેલ મિલ્કતનું વર્ણન : સમગ્ર જ	ਮੀਰ અને ਮਿલકત	, સમગ્ર જમીન	अने भिस्डत,

રોચલ રેસીડેન્સી, રેવેનું સર્વે નંબર ૧૨૯, બ્લોક નંબર ૧૪૬, રેવેનું સર્વે નંબર ૧૩૦, બ્લોક નંબ ૧૪૬/આ, રેવેનું સર્વે નંબર ૧૩૧/૧ઁ ૧૩૧/૧, બ્લોક નંબર ૧૪૮ અને રેવેનું સર્વે નંબર ૧૩૩, બ્લો નંબર ૧૪૮, કુલ શેત્રકુળ ૪૧૮૫૫ ચોરસ મીટર પૈકી, કે જે.પી. બ્લોક નંબર ૧૪૬, ગામ- સોચણનં તાલુકા- પલસાણા, જિલ્લો- સુરત, ્ર પૂર્વમાં સોસાચટી રોડ, પશ્ચિમમાં- પ્લોટ નંબર ૨૭૯, ઉત્તરય - પ્લોટ નંબર ૨૩७, દક્ષિણમાં - પલોટ નંબર ૨૩૯

	શ્રીમતી જયાબેન પટેલ (લોન લેનાર)	Rs.12,86,764/-	22.02.2019	17.03.2020
	શ્રી મહેશભાઈ રામુભાઇ સિંહ (સહ-દેવાદાર)	as on 22.02.2019	06.11.2020	CC/1658/201
2027 202	anni amber Gree ali amfa canna a		• 202121 000	2117 Dicc -

ગીરવે મુકવામાં આવેલ મિલ્કતનું વર્ણન : સમગ્ર જમીન અને મિલકત, રામગ્ર જમીન અને મિલ્કત પ્લોટ નંબર ૧૮૦, શેગકૃળ ૮૬,૨૦ ચોરસ થાર્ડ, ૭૨.૧૦ ચોરસ મીટર, રોડ અને સીઓપીટ આવિભાજિત હિસ્સા સાથે, વિશ્વાસ રેસીડેન્શી, બ્લોક નંબર ૩૨૨, શેગકૃળ ૩૪૩૬૬ ચોરસ મીટર મોજે ગામ કુંવરદા, તાલુકો માંગરોળ, જિલ્લો; સુરત, પૂર્વમાં - સીઓપી, પશ્ચિમમાં - રોડ, ઉત્તરમાં પ્લોટ નંબર ૧૮૧, દક્ષિણમાં-પલોટ નંબર ૧૦૯

શ્રી મહેશબાબુ પાલ (લોન લેનાર) શ્રીમતી પુષ્પદેવી નીસ્જ પાલ (સહ-દેવાદાર) as on 30.04.2019 07.11.2020 CC/999/2019

ગીરવે મૂકવામાં આવેલ મિલ્કતનું વર્ણન : સમગ્ર જમીન અને મિલકત, સમગ્ર જમીન અને મિલ્ક લીટ નંબર દર, શેગફળ ૪૦.૧૫ ચોરકા મીટર, રોડ અને રીઓપીમાં ૨૦.૬૨ ચોરકા મીટર હાંદ્ર નંબર દર, શેગફળ ૪૦.૧૫ ચોરકા મીટર, રોડ અને રીઓપીમાં ૨૦.૬૨ ચોરકા મીટર બ્રાવિભાષિત હિસ્સા સાથે, ગોવિંદજી પાર્ક સોસાચટી, રેવેનું નંબર ૯૪, બ્લોક નંબર ૧૨૩, ક્લ શેયફળ ૧-૩૪-૩૮ હેક્ટર આરે ચોરસ મીટર, આકાર રૂપિયા ૧७.૫૬, મોજે ગામ બગુમરા, તાલુ ાલસાણા, જિલ્લો; સુરત, પૂર્વમાં - સોસાઈટી રોડ, પશ્ચિમમાં - પ્લોટ નંબર ૧૧૧, ઉત્તરમાં - પ્લો ાંબર ૯૫, દક્ષિણમાં - પલોટ નંબર ૯७

સહી/- ,અધિકૃત અધિકારી, પિટલ ફાઇનાન્શ્યલ સર્વિસીસ લિમિટે સ્થળ - સુરત તારીખ - ૧૧.૧૧.૨૦૨૦ ટાટા કેપિટલ ફાઇનાન

વિજલપોર સીટી ગાર્ડનમાં ધરેથી ૩૪ હજારના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો બાતમીના આધારે પોલીસે મુળ વિજલપોર સરદાર ચોક સીટી ગાર્ડન ૧૮

ગાળાની સામે પાણીની ટાંકોં પાસે રહેતા કનેશના ધરે છાપો માર્ચો

નવસારી

ઁ વિજલપોર સીટી ગાર્ડનમાં ઘરે વિજલપોર પોલીસ બાતમીના આધારે છાપો મારી ૩૪ હજારના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી

મળતી માહિતી મુજબ, વિજલપોર પોલીસને બાતમી મળી હતી કે, વિજલપોર સીટી ગાર્ડનમાં રહેતા કનેશ ઉર્ફે કની રવજીભાઇ રાઠોડ તેના ધરમાં વિદેશી દારૂનો જથ્થો રાખી



વેચાણ કરે છે. જે બાતમીના પોલીસે આધારે વિજલપોર સરદાર ચોક શુશ્રૃષા હાથ ધરી છે.

હોસ્પિટલની સામે અને હાલ વિજલપોર સીટી ગાર્ડન ૧૮ ગાળાની સામે પાણીની ટાંકી પાસે રહેતા કનેશના ધરે છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસને ૩૪,૭૪૦ રૂપિયાના વિદેશી દારૂની ૫૧૬ નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે કનેશ ઉર્ફે કનીને ઝડપી પાડયો હતો. સાથે જ પોલીસે પ હજાર રૂપિયાનો મોબાઇલ મળી કુલ્લે ૩૯,૭૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ

રણોદ્રા ગામ પાસેથી ૧.૭૮ લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે ૨ ઝડપાયા

નવસારી,

નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર રણોદ્રા ગામ પાસેથી દારૂ ભરેલી કારે અન્ય કાર સાથે અકસ્માત કર્યુ હત. જેમાંથી પોલીસને ૧.૭૮ લાખનો વિદેશી દારૂ મળી આવતા પોલીસને બે લોકોને ઝડપી પાડયા

મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીનાં આધારે નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર રણોદ્રા ગામ પાસેથી એક ઇનોવા કાર (નં. જીજે-૨૭-બીઇ-૯૧૩૧) ને રોકવાનો -યાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર ભગાવી દેતા દારૂ ભરેલી કાર સ્વિક્ટ કાર (નં. ડીડી-૦૩-ક્યુ-૦૦૮૦) સાથે અકસ્માત થયો હતો. જ્યાં પોલીસે ઇનોવા કારની તપાસ કરતા તેમાંથી પોલીસને ૧,૭૮,૩૮૦ રૂપિયાના વિદેશી દારૂની ૧૧૪૦ નંગ બાટલીઓ મળી આવી હતી.

અમે જીતની ઉજવણી નહીં કરીએ : કિરીટસિંહ

લીબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ચૂંટણી જીતી ગયા છે. પરંતુ ભાજપના ઉમેદવાર કિરીટસિંહને એટલી લીડ મળી છે કે તેમની જીત નિશ્ચિત છે. આ પ્રસંગે તેમણે મીડિયાને સંબોધતા રડી પડ્યા ભારતીય જનતા પાર્ટીમાં કોઇ જ્ઞાતિ કે હતા અને તેમણે જણાવ્યું હતું કે, અમે સમાજનું કોઇ સમિકરણ નથી હોત્ . તે દલિત ભાઇ ગૂમ થયો છે.

જીતની કોઇ ઉજવણી નહીં કરીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, વિકાસના કામો કરવાના છે. ઉજવણી નથી કરવાના કારણ કે, જે ઘટના બની છે તે મારા મિત્ર પણ હતા અને સર્વે જ્ઞાતિના પ્રેમી માણસ પણ હતા.

મોર્ચાના પ્રમુખ હતા અને હજી લીંબડી તાલુકાનાં પ્રમુખ કિરપાલભાઇ હજી લાપતા છે. તો અમે કોઇ સરઘસ પણ નથી કાઢવાના કે રંગ પણ નથી ઉડાડવાના કોઇજાતની ઉજવણી નથી કરવાના. મારો કાર્યકર્તા મારો



arat - 394 660. Tel.: +91 2624 220228 / 220278-80; Fax: +91 2624 220138; nouse, 4 Bahadur Shah Zafar Marg, New Delhi – 110 002. **Tel**: +91 11 6600 1132, 2331 1112-5; **Website:** www.jkpaper.com

POST BUYBACK PUBLIC ADVERTISEMENT FOR THE ATTENTION OF EQUITY SHAREHOLDERS/BENEFICIAL OWNERS OF EQUITY SHARES OF JK PAPER LIMITED

This post buyback public announcement (the "Post Buyback Public Announcement") is being made in accordance with Regulation 24(vi) and other applicable provisions of the Securities and Exchange Board of India (Buy-Back of Securities) Regulations, 2018, for the time being in force including any statutory modifications and amendments from time to time ("Buyback Regulations") regarding completion of the Buyback (as defined below). This Post Buyback Public Announcement should be read in conjunction with Public Announcement dated 29" April 2020 and published on 30" April 2020 ("Public Announcement"), issued in connection with the Buyback (as defined below).

1.1. Pursuant to the provisions of Sections 68, 69, 70, and all other applicable provisions, if any, of the Companies Act, 2013, as amended ("Companies Act" or the "Act"), the Companies (Share Capital and Debentures) Rules, 2014 ("Share Capital Rules"), the Companies (Management and Administration) Rules, 2014 ("Management Rules"), and the provisions of the Buyback Regulations, Articles of Association of the Company and pursuant to the resolutions passed by the Board of Directors of the Company (the Board of Directors of the Company are hereinafter referred to as the "Board" or the "Board of Directors") at its meeting held on 28th April 2020 ("Board") and the "Board of Directors" are the Company are hereinafter referred to as the "Board" or the "Board of Directors" at its meeting held on 28th April 2020 ("Board") are the "Board" or Meeting"), the Board approved the buyback of the Company's fully paid-up equity shares of the face value of ₹ 10/- (Rupees Ten only) each ("Equity Shares") from its shareholders / beneficial owners excluding promoters, promoter group and persons who are in control of the Company, via the 'open market' route through the stock exchanges, for a total amount not exceeding ₹ 100,00,00,000 (Rupees One Hundred Crore only) ("Maximum Buyback Size"), and at a price not exceeding ₹ 130 (Rupees One Hundred and Thirty only) per Equity Share ("Maximum Buyback Price"), payable in cash (the process being referred hereinafter as "Buyback"). The Maximum Buyback Size does not include any expenses incurred or to be incurred for the Buyback like filling fees payable to SEBI, advisors' fees, stock exchange fees, brokerage, applicable taxes including, inter alia, securities transaction tax, goods and services tax, stamp duty, etc., public announcement publication expenses, printing and despatch expenses and other incidental and related expenses ("Transaction Costs").

1.2. The Maximum Buyback Size represents 5.67% and 5.71% of the aggregate of the total paid-up Equity Share capital and free reserves (which includes the securities premium account) of the Company based on the standalone and consolidated audited financial statements of the Company as on 31st March 2019, respectively (being the latest available audited standalone and consolidated financial statements of the Company as on the date of Public Announcement). Further, since the Maxim Buyback Size was not more than 10% of the total paid – up Equity Share capital and free reserves of the Company in accordance with the proviso to the Section 68(2)(b) of the Act, approval of the shareholders of the Company was not required.

1.3. The Public Announcement for the Buyback was published on 30th April 2020 in all editions of The Financial Express*, the English national daily newspaper, Jansatta, the Hindi national daily newspaper and in Surat edition of Janadesh, Gujarati newspaper, a regional language daily where the registered office of the Company is situated. *As informed by the publication, as a result of then ongoing lock-down due to COVID-19, Public Announcement in Pune edition of The Financial Express was published only in

1.4. The Buyback commenced on 8th May 2020 and completed on 6th November 2020. Till the date of completion of Buyback, the Company has utilized approximately 83.41% of the Maximum Buyback Size (excluding Transaction Costs)

1.5. The Committee of Directors of the Company took note that in terms of the Public Announcement, 6th November 2020, being the completion of six months from the date of commencement of the Buyback, is the last date for completion of the Buyback. Accordingly, the Committee of Directors of the Company approved the completion and closure of the Buyback on 6" November 2020. Intimation for completion and closure of the Buyback was sent to the Stock Exchanges on 6" November 2020.

1.6. Total number of Equity Shares bought back under the Buyback is 88,41,241 Equity Shares.

2. DETAILS OF THE BUYBACK

2.1.The Company bought back an aggregate of 88,41,241 Equity Shares, utilizing a total of Rs. 83,41,27,621.45 (Rupees Eighty three crore forty one lakh twenty seven thousand six hundred twenty one and forty five paisa only) (excluding Transaction Costs), which represents approximately 83.41% of the Maximum Buyback Size. The price at which the Equity Shares were bought back was dependent on the price quoted on the Stock Exchanges. The highest price at which the Equity Shares were bought back was Rs. 103.00 per Equity Share while the lowest price was Rs. 85.50 per Equity Share. The Equity Shares were bought back at an average price of Rs. 94.34508 per Equity Share. These prices are based on contract notes issued by JM Financial Services Limited ("Company's Broker") and exclude Transaction Costs. 2.2. The pay-out formalities have been completed as per settlement mechanism with the Stock Exchanges. The Company has extinguished 84,39,783 Equity Shares till date

and the Company is in the process of extinguishing the remaining 4,01,458 Equity Shares bought back.

2.3. All Equity Shares bought back were in the demat segment from the Stock Exchanges. As the Buyback was done from the open market through the Stock Exchanges, the identity of members from whom Equity Shares exceeding 1% of the total Equity Shares was, if any, bought in the Buyback, is not known.

3. CAPITAL STRUCTURE AND SHAREHOLDING PATTERN 3.1. The capital structure of the Company as on the date of the Public Announcement and post-Buyback, is as under

Particulars	As on the date of the	Public Announcement	Post-Buyback ⁽¹⁾		
	No. of Shares	Amount (in Rs.)	No. of Shares	Amount (in Rs.)	
Authorised Share Capital:					
Equity Shares of Rs. 10 each	30,00,00,000	300,00,00,000	30,00,00,000	300,00,00,000	
Preference Shares of Rs. 100 each	2,00,00,000	200,00,00,000	2,00,00,000	200,00,00,000	
ssued, subscribed and fully paid-up Share Capital:					
Equity Shares of Rs. 10 each	17,82,43,585	178,24,35,850	16,94,02,344	169,40,23,440	

Equity Share Capital is assuming extinguishment of all Equity Shares bought back by the Company.

Shareholder	Pre-Buyback(1)		Post-Buyback(2)	
	Number of Equity Shares	% of Equity Shares	Number of Equity Shares	% of Equity Shares
(A) Promoter & Promoter Group	8,71,37,211	48.89	8,71,37,211	51.44
(B) Public	9,11,06,374	51.11	8,22,65,133	48.56
(C1) Shares underlying DRs	-			
(C2) Shares held by Employee Trust	-	-		
(C) Non-Promoter Non Public (C = C1 + C2)	-	-		
Grand Total (A+B+C)	17,82,43,585	100.00	16,94,02,344	100.00

Dut of the total of 88,41,241 Equity Shares bought back, the Company is in the process of extinguishing the balance of 4,01,458 Equity Shares. The post Buyback Equity Share Capital is assuming extinguishment of all Equity Shares bought back by the Company.

4. MANAGER TO THE BUYBACK

Place: New Delhi

JM FINANCIAL

JM Financial Limited 7th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai – 400 025, Maharashtra, India. Tel.: +91 22 6630 3030; Fax: +91 22 6630 3330 Contact Person: Ms. Prachee Dhuri; Email: jkpaper.buyback@jmfl.com; Website: www.jmfl.com; SEBI Registration Number: INM000010361 Validity Period: Permanent Registration; Corporate Identity Number: L67120MH1986PLC038784

For further details, please refer to the Company's website (www.jkpaper.com) and the websites of the Stock Exchanges (i.e. www.bseindia.com and

www.nseindia.com) DIRECTORS' RESPONSIBILITY STATEMENT

As per Regulation 24(i)(a) of the Buyback Regulations, the Board of Directors of the Company accepts full and final responsibility for the information contained in this Post Buyback Public Announcement and confirms that such document contains true, factual and material information and does not contain any misleading information. For and on hehalf of the Board of Directors of JK Paner Limited

	Tot and on bonan of the board of birottors of ok rapor Emittor							
Sd/-		Sd/-	Sd/-					
ı	Harsh Pati Singhania	Amar Singh Mehta	Deepak Gupta					
l	Vice Chairman & Managing Director	President & Director	Company Secretary					
ı	DIN: 00086742	DIN : 00030694	ICSI Membership Number: F4615					
ı	Date: November 10, 2020							